



DJJ-002-002408 Seat No. _____

M. Com. (Sem. IV) (CBCS) Examination

May / June – 2015

ELE-5 : Advanced Corpo. A/c

(Group - A) (A/c & Taxation)

Faculty Code : 002

Subject Code : 002408

Time : 2½ Hours]

[Total Marks : 70

- સૂચના : (1) M.C.Q. પ્રશ્નના જવાબ મુખ્ય ઉત્તરવહીમાં જ આપવાના છે.
(2) દરેક પ્રશ્નની જમણી બાજુ ગુણ દર્શાવેલ છે.
(3) જરૂરી ગણતરી જવાબનાં ભાગરૂપે દર્શાવો.

1 નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. 20

- (1) લિક્વિડેટરે કંપનીના દેવાં ચૂકવતી વખતે સૌ પ્રથમ નીચે મુજબની રકમની ચૂકવણી કરવાની હોય છે.
- (A) સલામત લેણદારો અને કામદારોનું લેણું
(B) પસંદગીના લેણદારો
(C) તરતા બોજધારી લેણદારો
(D) વિસર્જન ખર્ચ તથા લિક્વિડેટરનું મહેનતાણું
- (2) નીચેનામાંથી કયા લેણદારો “બિનસલામત” લેણદારો ગણાય છે ?
- (A) ચૂકવવાના બાકી ખર્ચા
(B) કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ
(C) સ્થાનિક સરકારનાં બાકી કરવેરા
(D) એક પણ નહીં

- (3) નીચેનામાંથી કઈ રકમનો “પસંદગીના લેણદારો” માં સમાવેશ થતો નથી?
- (A) દેવીહૂંડી (B) પ્રોવિડન્ટ ફંડ
(C) સરકારના કરવેરા (D) એક પણ નહીં
- (4) લિક્વિડેટરે કંપનીના દેવાંની ચુકવણી માટે બિનસલામત લેણદારોને કયા ક્રમે ચુકવણી કરવી જોઈએ ?
- (A) ઈક્વિટી શેરમૂડી કરતા પહેલાં
(B) ઈક્વિટી શેરમૂડી પછી
(C) પસંદગીના લેણદારોની પહેલાં
(D) પ્રેફરન્સ શેરમૂડીની પછી
- (5) કયા પ્રકારની શાખા પોતાનું અલગ પાકું સરવૈયું તૈયાર કરે છે ?
- (A) પરતંત્ર શાખા (B) સ્વતંત્ર શાખા
(C) જથ્થાબંધ શાખા (D) ઉપરમાંથી બધા જ પ્રકારની શાખા
- (6) ઉઘરાણીની મળેલી રકમ શોધવા માટે કયું ખાતું બનાવવું પડે છે ?
- (A) લેણદારનું ખાતું (B) દેવાદારનું ખાતું
(C) ફર્નિચરનું ખાતું (D) પેટારોકડનું ખાતું
- (7) શાખા ખાતું એ કયા પ્રકારનું ખાતું છે ?
- (A) માલ મિલકતનું ખાતું (B) ઉપજ ખર્ચ ખાતું
(C) વ્યક્તિનું ખાતું (D) ઉપરનામાંથી કોઈપણ નહિ
- (8) માર્ગસ્થ રોકડની આમનોંધ લખતી વખતે શાખા કોના ખાતે જમા કરે છે ?
- (A) રોકડ ખાતે (B) શાખા ખાતે
(C) મુખ્ય ઓફિસ ખાતે (D) માલ-મિલકત ખાતે

(9) કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક કરે છે.

(A) ભારત સરકાર (B) વડાપ્રધાન

(C) રાષ્ટ્રપતિ (D) લોકસભા

(10) IGFRS-4 કઈ બાબત સંબંધીનું ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ છે ?

(A) સંભવિત દેવાં

(B) સરકારી મિલકતોના ખરીદ વેચાણ

(C) ઈન્વેન્ટરી

(D) સરકારી મહેસૂલી આવક ખર્ચ

(11) ભારતના રાષ્ટ્રપતિ બંધારણની કઈ કલમ હેઠળ કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક કરે છે ?

(A) કલમ-151 (B) કલમ-147

(C) કલમ-113 (D) કલમ-148

(12) GASA boardનાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે ?

(A) કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા

(B) ગવર્નર, RBI

(C) અધ્યક્ષ, C-A ઈન્સ્ટિટ્યૂટ

(D) ડેપ્યુટી, CAG

(13) GASABની મિટિંગ એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલીવાર મળવી જોઈએ ?

(A) બે વાર (B) છ વાર

(C) દર મહિને (D) ચાર વાર

(14) ખરીદ ખાતાવહીમાં શું નોંધવામાં આવે છે ?

(A) શાખ ખરીદી (B) તમામ ખરીદી

(C) રોકડ ખરીદી (D) મિલકતની ખરીદી

(15) સામાન્ય ખાતાવહીમાં દોરેલ વેચાણ ખાતાવહી હવાલા ખાતામાં શું નોંધાશે નહીં ?

- (A) ખરીદ પરત (B) વેચાણ પરત
(C) ઘાલખાધ (D) લેણીહૂંડી

(16) સામાન્ય રીતે “ચાલુ ખાતે” પત્રક કોણ કોને મોકલે છે ?

- (A) લેણદાર, દેવાદારને (B) દેવાદાર, લેણદારને
(C) ખાતેદાર, બેંકને (D) બધા પરસ્પર એકબીજાને

(17) એરીથમેટીક લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટને સંયુક્ત રીતે શું કહેવાશે ?

- (A) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (B) કમ્પ્યુટર
(C) હાર્ડવેર (D) સોફ્ટવેર

(18) આપણે કેટલી રીતે સોફ્ટવેરને વર્ગીકૃત કરી શકીએ.

- (A) 3 (B) 2
(C) 4 (D) 8

(19) ટેલીમાં F11ની મદદથી ઉપયોગ કરનાર શું બદલી શકે છે ?

- (A) એકાઉન્ટ
(B) વાર્ષિક હિસાબો
(C) એકમ(કંપની)ની લાક્ષણિકતાઓ
(D) બિલ

(20) ટેલીમાં પાકા સરવૈયામાં કેટલા મુખ્ય સમૂહ (Primary groups) દર્શાવાય છે ?

- (A) 5 (B) 6
(C) 8 (D) 9

2 ભારત કંપની લિમિટેડનું તા.31-12-2013નાં રોજ સ્વૈચ્છિક વિસર્જન કરવામાં 12

આવ્યું. તે જ દિવસે તેનાં ચોપડામાં નીચે મુજબની બાકીઓ હતી :

જમીન-મકાન	1,12,000
યંત્રો	74,000
રોકાણો	68,000
સ્ટોક	15,000
દેવાદારો	36,000
રોકડ-બેંક સિલક	27,500
નફા-નુકસાન ખાતું (ઉધાર બાકી)	70,000
પ્રાથમિક ખર્ચ	7,500
1000 7%નાં પ્રેફરન્સ શેર દરેક રૂ.100 પૂરા ભરપાઈ	1,00,000
"A" પ્રકારનાં 1000 ઈક્વિટી શેર	
દરેક રૂ.100નો (રૂ.80 ભરપાઈ)	80,000
"B" પ્રકારનાં 700 ઈક્વિટી શેર	
દરેક રૂ.100નો (રૂ.60 ભરપાઈ)	42,000
"C" પ્રકારનાં 800 ઈક્વિટી શેર દરેક	
રૂ.100નો (રૂ.40 ભરપાઈ)	32,000
5%નાં ગીરો ડિબેન્યર્સ	20,000
ડિબેન્યર્સ પર ચઢેલું વ્યાજ	1,000
લેણદારો	1,35,000
મિલકતોની ઉપજ જમીન-મકાન રૂ.84,400, યંત્રો રૂ.36,000, સ્ટોક રૂ.9,100, દેવાદારો રૂ.28,500	
કુલ લેણદારોમાં રૂ.5,000 પસંદગીનાં છે. આ ઉપરાંત રૂ.65,000નાં લેણદારોને ત્યાં રોકાણો ગીરવે છે, જે તેમણે રૂ.71,000 માં વેચ્યા અને વધારો લિક્વિડેટરને	

આપ્યો છે. રૂ.25,000નાં લેણદારોને 3% ઓછા તથા રૂ.10,000નાં લેણદારોને 35% ઓછા ચૂકવ્યા અને બાકીનાને પૂરેપૂરા ચૂકવ્યા. ડિબેન્ચરહોલ્ડરોને તા.31-6-2014નાં રોજ નાણાં ચૂકવ્યા. લિક્વિડેશન ખર્ચ રૂ.6,895 થયો. લિક્વિડેટરનું મહેનતાણું તેણે ઉપજાવેલ રકમના 3% (સલામત લેણદારો પાસેથી મળેલા વધારા સિવાયની) અને પસંદગીના લેણદારો સિવાયનાં બિનસલામત લેણદારોને ચૂકવેલ રકમના 2% લેખે ગણવાનું છે.

લિક્વિડેટરનું છેવટનું પત્રક તૈયાર કરો. જરૂરી ગણતરી દર્શાવો.

અથવા

- 2 રાજેશ લિ.તા.31-12-2012નાં રોજ સ્વૈચ્છિક ફડયામાં ગઈ. તે તારીખે ચોપડામાં 12 નીચે મુજબની બાકીઓ હતી :

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
2500 ઈક્વિટી શેર		જમીન-મકાન	3,00,000
દરેક રૂ.100નો	2,50,000	મશીનરી-પ્લાન્ટ	6,00,000
5000 6%નાં પ્રેફરન્સ		પેટન્ટ્સ	1,25,000
શેર દરેક રૂ.100નો	5,00,000	સ્ટોક	1,50,000
7500 ઈક્વિટી શેર		દેવાદારો	2,25,000
દરેક રૂ.100નો		રોકડ	75,000
રૂ.60 ભરપાઈ	4,50,000	ન.નુ.ખાતું	3,50,000
5%નાં ગીરો ડિબેન્ચર	2,50,000		
બાકી વ્યાજ	12,500		
લેણદારો	3,62,500		
	18,25,000		18,25,000

રોકડ સિવાયની મિલકતોમાંથી ઉપજેલી કિંમતના 3% અને પસંદગીના લેણદારો સિવાયના બિનસલામત લેણદારોને ચૂકવેલ રકમનાં 2% કમિશન મેળવવા લિક્વિડેટર હકદાર છે. મિલકતોની કિંમત નીચે પ્રમાણે ઉપજી.

જમીન મકાન રૂ.5,00,000, પેટન્ટ્સ રૂ.80,000, દેવાદારો રૂ.2,25,000, મશીનરી-પ્લાન્ટ રૂ.4,00,000, સ્ટોક રૂ.1,25,000.

રૂ.30,000 વિસર્જન ખર્ચ થયો છે. લેણદારોમાંથી રૂ.37,500ના પસંદગીના લેણદારોનો અને જમીન-મકાનનાં તારણ ઉપર લોન રૂ.1,25,000નો સમાવેશ થાય છે. પ્રેક્ટરન્સ ડિવિઝન બે વર્ષનું બાકી છે. લિક્વિડેટરનું આખરનું હિસાબી પત્રક તૈયાર કરો.

- 3 મહેશ એન્ડ કંપનીની મુખ્ય ઓફિસ ન્યૂયોર્ક (યુ.એસ.એ.) ખાતે અને શાખા મુંબઈ (ભારત) ખાતે આવેલી છે. મુંબઈની શાખા કંપનીની આંતરિક વિદેશી કાર્યકારી શાખા છે. મુંબઈ શાખા તેનું તા.31-3-2014નાં રોજનું કાર્યું સરવૈયું નીચે મુજબ દર્શાવે છે :

વિગત	ઉધાર રૂ.	જમા રૂ.
સ્ટોક તા.(1-4-2013)	7,50,000	-
ખરીદ અને વેચાણ	22,00,000	40,70,000
દેવાદારો અને લેણદારો	11,00,000	8,00,000
હૂંડીઓ	3,75,000	7,00,000
કમ્પ્યુટર	7,50,000	-
પગાર	6,05,000	-
મજૂરી	5,83,000	-
ભાડું, વેરા અને અન્ય	8,25,000	-
પરચૂરણ ખર્ચ	3,74,000	-
બેન્ક સિલક	10,55,000	-
ન્યૂયોર્ક મુખ્ય ઓફિસનું ખાતું	-	30,47,000
	86,17,000	86,17,000

વધારાની માહિતી :-

- (1) ન્યૂયોર્ક મુખ્ય ઓફિસ તરફથી વર્ષ દરમિયાન US \$ 12,500 મળેલા છે. જેમાંથી કમ્પ્યુટરની ખરીદી તા.1-4-2013નાં રોજ કરેલી છે. તેની ચુકવણી કરી છે.
- (2) કમ્પ્યુટર પર 50% લેખે આખા વર્ષનો ઘસારો ગણો.
- (3) તા.31-3-2014નાં રોજ મુંબઈ શાખા ખાતે આખર સ્ટોક રૂ.12,00,000 હતો.
- (4) વિનિમય દર નીચે મુજબ ધ્યાનમાં લેવાનો છે :

એક US \$ = રૂ.60 તા.1-4-2013નાં રોજ

એક US \$ = રૂ.50 તા.31-3-2014ના રોજ

એક US \$ = રૂ.55 સરેરાશ વિનિમય દર

મુખ્ય ઓફિસનાં ચોપડે ભારતીય હિસાબી ધોરણ AS-11 મુજબ રૂપાંતરિત કાર્યું સરવૈયું, શાખા વેપાર ખાતું, ન.નુ. ખાતું અને તા.31-3-2014નાં રોજનું પાકું સરવૈયું તૈયાર કરો. ન્યૂયોર્ક મુ.ઓ.નાં ચોપડે તા.31-3-2014નાં રોજ મુંબઈ શાખાની બાકી US \$ 55,000 ડોલર ઉધારી બાકી દર્શાવે છે.

અથવા

- 3 ભાવેશ લિ.રાજકોટની એક શાખા ગોંડલમાં છે. શાખાની 2013-14ના વર્ષની જરૂરી માહિતી નીચે મુજબ છે : 13

વિગત	31-3-2013 રૂ.	31-3-2014 રૂ.
ફર્નિચર	80,000	70,000
સ્ટોક	2,60,000	1,16,000
દેવાદારો	1,88,000	1,24,000
પેટા રોકડ	2,400	?

2013-14 દરમિયાનનાં વ્યવહારો :

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
દેવાદારો તરફથી માલ પરત	16,000	દેવાદારો તરફથી મળેલ રોકડ	6,64,000
શાખાને મોકલેલ માલ	4,08,000	દેવાદારોને વટાવ	8,800
શાખાને મોકલેલ પેટા રોકડ	6,800	શાખાનાં ખર્ચ માટે ચુકવણી	
ઘાલખાધ	8,000	ઓફિસ ખર્ચ	20,800
શાખાને પરત કરેલ માલ	7,200	નૂર-જકાત	7,600
પરચૂરણ ખર્ચ ચૂકવેલ	6,000	મજૂરી ખર્ચ	48,400
કુલ વેચાણ		ભાડું	24,800
(રોકડ વેચાણ સહિત)	8,40,000	પગાર	51,600
		જાહેરાત	10,000

તૈયાર કરો : તા.31-3-2014ના રોજ પૂરા થતા વર્ષનું ગોંડલ શાખાનું શાખા ખાતું.

4 એક વેપારી શ્રીમાન ભરત પોતાનાં ચોપડાની બાકી કાઢવાની અનુકૂળતા રહે 12

તે હેતુથી પોતાની વેચાણ ખાતાવહી અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે બે વિભાગોમાં અનુક્રમે

A થી M અને N થી Z વહેંચી નાખે છે. જે દરેકને સામાન્ય ખાતાવહી હવાલા

ખાતાની મદદથી આપમેળી રાખવામાં આવેલ છે.

તા. 1 લી જૂન 2014નાં રોજ આ ખાતાં નીચેની બાકીઓ દર્શાવતા હતા :

વિગત	ઉધારબાકી(રૂ.)	જમા બાકી (રૂ)
A થી M હવાલા ખાતું	53.950	1,150
N થી Z હવાલા ખાતું	38.450	300

પ્રાથમિક નોંધો લખવામાં આવે છે. તે ચોપડા પરથી તા.30મી જૂન 2014ના રોજ પૂરા થતા માસ દરમિયાનનાં વ્યવહારોની મેળવેલ ટૂંકી માહિતી નીચે મુજબ છે :

વિગત	A થી M(રૂ.)	N થી Z(રૂ.)
ઉધાર વેચાણ	4,15,900	3,51,200
માલ પરત અને કસર	6,400	4,500
મળેલ રોકડ	3,83,700	3,25,400
માંડી વાળેલ ઘાલખાધ	3,200	4,200
ઘાલખાધ પરત		
(ઉપરની રોકડમાં સમાયેલ)	500	150
વટાવ આપ્યો	7,350	6,100
મળેલ હૂંડીઓ	22,500	7,800

જૂન માસ દરમિયાન કુમારી ગીતા નામની એક ગ્રાહક જેનું ખાતું રૂ.200 ઉધાર બાકી દર્શાવતું હતું તેણે શ્રી મયુર સાથે લગ્ન કર્યા અને તેથી તેણીનું ખાતું તેણીના નવા નામે બીજી ખાતાવહીમાં ફેરવવામાં આવેલ હતું. તા.30મી જૂન 2014ના રોજ A થી M ખાતાવહીમાં કુલ જમાબાકી રૂ.900 અને N થી Z ખાતાવહીમાં રૂ.450 હતી.

ઉપરોક્ત માહિતી ઉપરથી નીચેનાં ખાતાંઓ તૈયાર કરો :

(1) A થી M વેચાણ ખાતાવહીમાં : સામાન્ય ખાતાવહી હવાલા ખાતું.

(2) N થી Z વેચાણ ખાતાવહીમાં : સામાન્ય ખાતાવહી હવાલા ખાતું.

અથવા

4 શ્રી રામ પોતાનાં હિસાબો સ્વયં સંતુલિત ખાતાવહી પદ્ધતિથી રાખે છે. 12

તે નીચેની માહિતી પૂરી પાડે છે :

વિગત	રકમ રૂ.
તા.1-4-2014 નાં રોજ દેવાદારોની ખાતાવહીમાં (ઉધાર બાકી)	12,62,500
તા.1-4-2014 નાં રોજ દેવાદારોની ખાતાવહીમાં (જમા બાકી)	55,000
તા.1-4-2014 નાં રોજ લેણદારોની ખાતાવહીમાં (જમા બાકી)	10,10,000
તા.1-4-2014 નાં રોજ લેણદારોની ખાતાવહીમાં (ઉધાર બાકી)	90,000
રોકડ, વેચાણ.....	4,04,000
ઉધાર ખરીદી	22,50,000
ઉધાર વેચાણ	35,35,000
વેચાણ પરત.....	2,77,500
ખરીદ પરત	1,51,500
દેવાદારોને આપેલ રોકડ.....	7,500
લેણદારોને આપેલ રોકડ	20,70,000
દેવાદારો પાસેથી મળેલ રોકડ.....	34,34,000
દેવાદારોને આપેલ વટાવ	1,75,000

લેણદારો તરફથી મળેલ વટાવ	2,25,000
દેવાદારો પાસેથી મળેલ હૂંડીઓ	5,55,000
લેણદારોની સ્વીકૃત કરેલી હૂંડીઓ	3,40,000
લેણીહૂંડીઓ નકરાયેલી	10,000
વેચાણ ખાતાવહીમાંથી ખરીદ ખાતાવહીમાં ફેરબદલી	2,00,000
ઘાલખાધ માંડી વાળી	32,500
તા.31-3-2015નાં રોજ દેવાદારોની ખાતાવહી (જમા બાકી)	45,000
તા.31-3-2015નાં રોજ લેણદારોની ખાતાવહી (ઉધાર બાકી)	1,11,000

ઉપરની માહિતી પરથી સામાન્ય ખાતાવહીમાં જરૂરી હવાલા, ખાતાંઓ તૈયાર કરો.

- | | | |
|---|--|---|
| 5 | (1) સરકારી હિસાબી પદ્ધતિ અને વેપારી હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત. | 7 |
| | (2) કમ્પ્યુટરાઈઝડ હિસાબી પદ્ધતિના ફાયદા-મર્યાદા જણાવો. | 6 |

અથવા

- | | | |
|---|--|---|
| 5 | (1) કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની સત્તા અને ફરજો જણાવો. | 6 |
| | (2) કમ્પ્યુટરાઈઝડ હિસાબી પદ્ધતિ માટે જવાબદાર પરિબળો. | 7 |

ENGLISH VERSION

- Instructions :**
- (1) Give the answer of MCQ in main answer sheet.
 - (2) Figures to the right indicate marks of the questions.
 - (3) Show working notes as a part of your answer.

1 Choose the correct option from given alternatives and write. **20**

- (1) Liquidator has to pay the following amount at the time of payment of debt.
 - (A) Secured creditors and worker's debt
 - (B) Preferential creditors
 - (C) Creditors bearing immediate charge
 - (D) Liquidators remuneration and liquidation expense
- (2) Which of the following is considered unsecured creditors ?
 - (A) Outstanding expenses
 - (B) Employees provident fund
 - (C) Tax dues of local government
 - (D) None of the above
- (3) Which of the following is not covered under "Preferential creditors" ?
 - (A) Bills payable
 - (B) Provident fund
 - (C) Government taxes
 - (D) None of the above

- (4) Unsecured creditors are paid at what stage at the time of liquidation of the company ?
- (A) Before equity share capital
 - (B) After equity share capital
 - (C) Before paying to preferential creditors
 - (D) After preferential share capital
- (5) Which of the following branch prepares its separate balance sheet ?
- (A) Non-independent branch
 - (B) Independent branch
 - (C) Wholesale branch
 - (D) All the above
- (6) Which account is prepared in order to ascertain collection account ?
- (A) Creditors account (B) Debtors account
 - (C) Furniture account (D) Petty cash account
- (7) Branch account is what type of account ?
- (A) Asset account (B) Receipts account
 - (C) Personal account (D) None of the above
- (8) At the time of passing journal entry of cash in transit, which account will be credited ?
- (A) Cash Account (B) Branch account
 - (C) Head office account (D) Asset account
- (9) Comptroller and Auditor General of India is appointed by _____.
- (A) Government of India
 - (B) Prime Minister
 - (C) President
 - (D) Lok Sabha

- (10) The financial reporting standard IGFRS-4 is for_____.
- (A) Expected debts
 - (B) Purchase and sales of government assets
 - (C) Inventory
 - (D) Revenue income and expenditure of government
- (11) President of India appoints Comptroller and Auditor General of India as per _____ of the Indian Constitution.
- (A) Section 151
 - (B) Section 147
 - (C) Section 113
 - (D) Section 148
- (12) Who is the chairperson of the GASA board ?
- (A) Comptroller and Auditor General of India
 - (B) Governor of RBI
 - (C) Chairman of CA Institute
 - (D) Deputy, CAG
- (13) The meeting of GASAB meet at least _____ times in a year.
- (A) Two
 - (B) Six
 - (C) Every month
 - (D) Four
- (14) What is recorded in purchase ledger ?
- (A) Credit purchases
 - (B) All purchases
 - (C) Cash purchases
 - (D) Purchase of assets
- (15) What is not recorded in sales ledger adjustment account of general ledger ?
- (A) Purchase return
 - (B) Sales return
 - (C) Bad debts
 - (D) Bills receivable

- (16) The “current account” statement is forwarded to _____.
- (A) Debtors by creditors
 - (B) Debtors, creditors
 - (C) Account holder, bank
 - (D) All the above
- (17) Arithmetic logic unit and control unit together called _____.
- (A) Central processing unit
 - (B) Computer
 - (C) Hardware
 - (D) Software
- (18) In how many ways software can be classified ?
- (A) 3
 - (B) 2
 - (C) 4
 - (D) 8
- (19) F11 in Tally helps in changing _____.
- (A) Account
 - (B) Annual accounts
 - (C) Characteristics of the company
 - (D) Bill
- (20) How many primary groups are shown in final balance sheet in Tally ?
- (A) 5
 - (B) 6
 - (C) 8
 - (D) 9

2 Bharat Co. Limited went into voluntary liquidation on 12

31st December 2013. The balances as on that date were as
under :

	Rs.
Land and Building.....	1,12,000
Machinery	74,000
Investments	68,000
Stock	15,000
Debtor.....	36,000
Cash and Bank Balance	27,500
Profit and Loss Account debit balance	70,000
Preliminary expenses	7,500
1000, 7% preference shares of Rs. 100 each	1,00,000
1000, "A" equity share of Rs. 100 (Rs. 80 paid up)	80,000
700, "B" equity shares of Rs. 100 each (Rs. 60 paid up)	42,000
800 "C" equity shares of Rs. 100 each (Rs. 40 paid up).....	32,000
5% mortgage debenture	20,000
Outstanding interest on debentures.....	1,000
Creditors	1,35,000

Assets realised : Land and Building Rs. 84,400,
Machinery Rs. 36,000; Stock Rs. 9,100; Debtors Rs. 28,500.

Creditors include preference creditors of Rs. 5,000. Investments
were mortgaged with creditors of Rs. 65,000 who realised
71,000 of the same. The excess was given to liquidator.
Creditors of Rs. 25,000 were paid 3% less and creditors of

Rs. 10,000 were paid 35% less. - Remaining creditors were paid fully. Debentureholders were paid on 30.6.2014. Liquidation expenses were Rs. 6,895. Liquidator is entitled to a remuneration of 3% on the assets realised by him and 2% on the amount distributed to unsecured creditors other than preferential creditors.

Prepare Final Statement of Liquidator. Show necessary calculation.

OR

2 Rajesh Ltd. went into voluntary liquidation on 31.12.12. 12

The balances in its books on date were :

Liabilities	Rs.	Assets	Rs.
2,500 equity shares of Rs. 100	2,50,000	Land and Buildings	3,00,000
5,000 6% preference share of Rs. 100	5,00,000	Machinery and Plants	6,00,000
7,500 equity shares of Rs. 100 each		Patents	1,25,000
Rs. 60 paid	4,50,000	Stock	1,50,000
5% mortgaged debentures	2,50,000	Debtors	2,25,000
Interest outstanding	12,500	Cash	75,000
Creditors	3,62,500	P/L Account	3,50,000
	18,25,000		18,25,000

The liquidator is entitled to a commission of 3% on all assets realised except cash and 2% amount distributed to unsecured creditors other than preferential creditors, the assets realised as follows :

Land and Building.....	Rs. 5,00,000
Patents	Rs. 80,000
Debtors	Rs. 2,25,000
Machinery	Rs. 4,00,000
Stock	Rs. 1,25,000
The expenses of liquidation amounted	Rs. 30,000.

Creditors include preferential creditors Rs. 37,500 and a loan for Rs. 1,25,000 secured by a mortgage on land and buildings. the preference dividends were in arrears for two years.

Prepare the Liquidator's final statement of Accounts.

- 3 Mahesh has head office at New York (U.S.A.) and branch at 13 Mumbai (India). Mumbai branch is an integral foreign operation of Mahesh & Co.

Mumbai branch furnished you with its trial balance as on 31st March 2014 and the additional information given thereafter :

Particulars	Debit Rs.	Credit Rs.
Stock on (1.4.13)	7,50,000	-
Purchase and sales	22,00,000	40,70,000
Sundry debtors and creditors	11,00,000	8,00,000
Bill of exchange	3,75,000	7,00,000
Computers	7,50,000	-
Salaries	6,05,000	-
Wages	5,83,000	-
Rent, rates and taxes	8,25,000	-
Sundry charges	3,74,000	-
Bank balance	10,55,000	-
New York Office A/c.	-	30,47,000
	86,17,000	86,17,000

Additional Information :

- (1) Computers were acquired from a remittance of US \$ 12,500 received from New York office and paid to the suppliers (Computer purchase date 1.4.13)
- (2) Depreciate computers at 50% for the year.
- (3) Unsold stock of Mumbai branch was worth Rs. 12,00,000 on 31st March 2014.
- (4) The rate of exchange may be taken as follows :
On 1.4.13 @ Rs. 60 per US \$
On 31.3.14 @ Rs. 50 per US \$
Average exchange rate for the year @ Rs. 55 per US \$.

Prepare in the book of head office converted trial balance, Trading Account. Profit and Loss Account and Balance Sheet as on Dt. 31.3.2014 as per AS-11. Branch account balance was shown as dollar 55,000 as debit in the book of head office.

OR

- 3** Bhavesh Ltd. Rajkot has a branch in Gondal. Particulars **13**
for 2013-14 are as under :

Particulars	31.3.13 Rs.	31.3.14 Rs.
Furniture	80,000	70,000
Stocks	2,60,000	1,16,000
Debtors	1,88,000	1,24,000
Petty cash	2,400	?

Transactions during 2013-14 :

Particulars	Rs.	Particulars	Rs.
Goods return by		Cash received	
debtors	16,000	from debtors	6,64,000
Goods sent to branch	4,08,000	Discount allowed	
Petty cash sent to		to debtors	8,800
branch	6,800	Payment for branch exp.	
Bad Debt	8,000	Office expenses	20,800
Goods return		Freight-octroi	7,600
by branch	7,200	Labour expenses	48,400
Petty cash		Rent	24,800
expense paid	6,000	Salaries	51,600
Total Sales		Advertisement	10,000
(including cash sales)	8,40,000		

Prepare Gondal Branch A/c. for the year ended 31.3.14

- 4 Bharat maintains its sales ledger alphabet wise in two **12**
 parts A to M and N to Z. Each one is being made self balancing
 with the helps of General Ledger Adjustment A/c.

Balances as on 1.6.2014 were as below :

Particulars	Dr. Rs.	Cr. Rs.
A to M Adj. A/c.	53,950	1,150
N to Z Adj. A/c.	38,450	300

Transactions during month of June :

Particulars	A to M	N to Z
	Rs.	Rs.
Goods sold on credit	4,15,900	3,51,200
Sales return and Disc.	6,400	4,500
Cash received	3,83,700	3,25,400
Bad debts	3,200	4,200
Bad debts recovered		
(included in above cash)	500	150
Discount allowed	7,350	6,100
Bills received	22,500	7,800

During month of June a customer Miss Geeta whose account shows Rs. 200 debit balance got marriage with Mr. Mayur and her account transferred to another Ledger. At the end of the month the credit balance were A to M Ledger Rs. 900 and N to Z Ledger Rs. 450.

You are required to prepare :

- (1) General Ledger Adj. Account in A to M Sales Ledger
- (2) General Ledger Adj. A/c. in N to Z Sales Ledger.

OR

- 4 Mr. Ram maintains his books on self balancing ledgers. 12

He provides the following information :

Particulars	Rs.
Debit balance in the debtors ledgers on 1.4.14	12,62,500
Credit balance in the debtors ledgers on 1.4.14	55,000
Credit balance in the creditors ledgers on 1.4.14	10,10,000
Debit balance in the creditors ledgers on 1.4.14	90,000
Cash sales	4,04,000
Credit purchase	22,50,000
Credit sales	35,35,000
Sales Return	2,77,500
Purchase Return	1,51,500
Cash paid to debtors	7,500
Cash paid to suppliers	20,70,000
Cash received from the customers	34,34,000
Discount allowed to customers	1,75,000
Discount received from the suppliers	2,25,000
Bills receivable received from customers	5,55,000
Bills payable given to suppliers	3,40,000
Bills receivables dishonoured	10,000

Transfer from sales ledger to purchase..... 2,00,000

Bad debts..... 32,500

Credit balance in the debtors ledgers on 31.3.15 45,000

Debit balance in the creditors ledgers on 31.3.15 1,11,000

From the above information, prepare Relevant Adjustment
Accounts that would appear in the General Ledger.

- 5 (i) Government Accounting and Commercial Accounting. 7
- (ii) State the merits and demerits of Computerized
Accounting System. 6

OR

- 5 (i) Explain the rights and duties of Comptroller and
Auditor General of India. 6
- (ii) Factors responsible for Computerized Accounting. 7
